

મે 9, 2018

સીટી કાઉન્સિલ બ્રામ્પટન માટેના હિંમતવાન નવા દૂરદેશીપણાંને (બોલ્ડ ન્યૂ વિઝનને) સમર્થન આપે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – સઘન સામુદાયિક વચનબદ્ધતાના મહિનાઓ વિત્યા પછી, ભાવિ બ્રામ્પટન માટે હિંમતવાન નવું દૂરદેશીપણું તૈયાર છે. સીટી કાઉન્સિલે સોમવાર, મે 7 નાં રોજ યોજાયેલી કાઉન્સિલની ખાસ બેઠકમાં [બ્રામ્પટન 2040 વિઝન: લિવિંગ ધી મોઝેઈક](#)ને સમર્થન આપ્યું.

બ્રામ્પટન 2040 વિઝન એ આ સદીના આગામી ચોથા ભાગના વર્ષો ઉપરાંતના સમયમાં બ્રામ્પટનમાં શું બનશે તેનું માર્ગદર્શન આપતો મહત્વાકાંક્ષી દસ્તાવેજ છે. આ દૂરદેશીપણાંના હાર્દમાં સાત મહત્વાકાંક્ષી દૂરદેશીપણું વ્યક્તવ્યો છે જે પર્યાવરણ, પરિવહન, નોકરીઓ, મનોરંજન, આરોગ્ય, સામાજિક મુદ્દાઓ, અને કળા અને સંસ્કૃતિ સાથે વ્યવહાર કરે છે. તેમાં દરેક દૂરદેશીપણું વ્યક્તવ્યને હકીકત બનાવવામાં મદદરૂપ થતી 28 ચોક્કસ કાર્યવાહીઓનો સમાવેશ થાય છે.

“ન્યૂ રાયરસન યુનિવર્સિટી કેમ્પસથી માંડીને, આપણાં ઈલેક્ટ્રિક બસના પાઈલોટ પ્રોજેક્ટ સુધી, આપણી પ્રચંડ રચનાત્મક પ્રતિભાઓને પોષતા આપણાં ઉદભવી રહેલા સંસ્કૃતિક દેખાવ સુધી, બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે,” મેયર લિન્ડા જૈફરીએ કહ્યું. “બ્રામ્પટન 2040 વિઝન એવી ઘણી પહેલો પર બનાવવામાં આવ્યું છે જે તે પહેલોને હિંમતવાન અને નવીનતમ રીતે સાકાર બનાવે, અને તે આપણાં શહેરને મોટા પાયે વિચારવા અને જુદી રીતે કામ કરવાનો પડકાર ફેંકે છે. આ નોંધપાત્ર પરિવર્તન હાંસલ કરવાનું સરળ રહેશે નહિ અને તેમાં હિંમત જોઈશે, પરંતુ આપણાં રહેવાસીઓએ નવા લોકોના આ દૂરદેશીપણાંને અપનાવ્યું છે.”

આ દૂરદેશીપણાંની શરૂઆત વર્ષ 2017 નાં મધ્યમાં થઈ, જેમાં એક સંયોજિત, સર્વગ્રાહી અને નવીનતમ શહેર તરીકે બ્રામ્પટનના ભવિષ્યને માર્ગદર્શન આપતો વ્યાપક દસ્તાવેજ વિકસાવવામાં આવ્યો. આ શહેરે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શહેરી આયોજક (અર્બન પ્લાનર) લેરી બીઝલી સાથે ભાગીદારી કરી, જેઓએ દુનિયાભરમાં દૂરદેશીપણું દેખાડતા શહેરી મોડેલો બનાવ્યા છે. તેની અનુગામી બાબત સમગ્ર સમુદાયને આવરી લેતો વ્યાપક સંવાદ હતો. એક નવીનતમ આનંદાઈન વચનબદ્ધતા પ્લેટફોર્મ અને તમામ ઉંમરના, પશ્ચાદભૂના અને અનુભવો ધરાવતા લોકો સાથે વાત કરવા સમગ્ર શહેરમાં પ્રવાસ કરનાર કટિબદ્ધ સ્ટ્રીટ ટીમ સાથે, શહેરમાં અગાઉ ક્યારેય હાથ ધરવામાં આવી હોય તેવી સૌથી ખડતલ જાહેર વચનબદ્ધતા હતી.

“બ્રામ્પટન 2040 વિઝન દુનિયાભરમાં શ્રેષ્ઠ પ્રથાઓ સાથે મિશ્રિત થઈને, જાહેર વચનબદ્ધતા પર બનેલું છે,” વિઝન ઈનિશિએટિવના પ્રોજેક્ટ મેનેજર, એન્ટોનિએટ્ટા મિનિશિલોએ કહ્યું. “આ ભવિષ્ય માટે ન કેવળ સીટી ઓફ બ્રામ્પટનનું, પરંતુ સમુદાયનું દૂરદેશીપણું બને તે મહત્વનું હતું. અમે વિતેલા જૂજ મહિનાઓ ઉપરાંતના સમયમાં સહભાગી થયેલા હજારો રહેવાસીઓનો આભાર માનીએ છીએ, અને અમે પ્રવાસના આગામી તબક્કા માટે આશાવાદી છીએ.”

કર્મચારીઓ હવે વ્યાપક અમલીકરણ યોજના પર કામ શરૂ કરશે જે અગ્રતાઓ નક્કી કરે છે અને અંદાજપત્ર ફાળવણી, નીતિગત ફેરફારો અને નવી ભાગીદારીની તકો જેવી બાબતોમાં ગૂઢ કામગીરી કરે છે. અમલીકરણ અહેવાલ આગામી મહિનાઓમાં કાઉન્સિલને રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તાણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca